

મોબાઇલ રનેચીંગ તેમજ ચોરીના ગુનાઓ આચરી નાસતા હરતા આરોપીને
ઝડતી પાડતી, રાંદેર પોલીસ.

સુરત શહેરના રાંદેર પો.સ્ટે. વિસ્તારમાં વણશોધાયેલ ગુનાઓ શોધી કાઢવા અંગેની પો.સ્ટે.ના પોલીસ માણસો પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન અ.પો.કો. વિપુલ શાંભાભાઇ તથા અ.પો.કો. ઉદય ભીમજીભાઇ નાઓને બાતમી હકીકત મળેલ કે “અબ્દુલ કારીર ઉર્ફ કાદીર રૂકનુદીન સૈયદ તથા મજહર મુનિરખાન પઠાણ નામના ઇસમ હાલમાં સુરત રાંદેર, ભેસાણ ચાર રસ્તા પાસે ખહેરમાં એક પ્લાસ્ટીકની થેલીમાં ચોરી કરેલ મોબાઇલ ફોન તથા અન્ય ચીજવસ્તુ વેચાણ કરવા સારૂ ઉભેલા છે વિગેરે બાતમી હકીકત આધારે પ્રો.પો.સ.ઇ. કે.બી.દેસાઇ તથા તેઓની ટીમના પોલીસ કર્મચારીઓને ટીમવર્ક આઉટથી આરોપીઓ(૧) અબ્દુલ કારીર ઉર્ફ કાદીર રૂકનુદીન સૈયદ ઉ.વ.૧૯ ઇંધો-પ્લમ્બરની મજુરીકામ રહે.ઘર નં.૩૦૮૯, ભરૂચી ભાગળ રાંદેર, સુરત. મુળ વતન-ચોખડે તા.જિ-વડોદરા તેમજ (૨) મજહર મુનિરખાન પઠાણ ઉ.વ.૨૩ ઇંધો-વેપાર રહે.ઘર નં.૩૦૯૪, ભરૂચી ભાગળ રાંદેર, સુરત મુળ વતન-પીપરાતાલ તા.બદલશાહ જિ.કેઝાબાદ (ઉત્તરપ્રદેશ) નાઓને પકડી પાડી તેઓની પાસેથી મોબાઇલ ફોન તેમજ ઘરફોડ ચોરીનો મુદ્દામાલ રીકવર કરવામા આવેલ છે જે નીચે મુજબ છે.

રીકવર મુદ્દામાલ:

(૧) મોટારોલા કપનીનો કાળા કલરનો મોડલ ૭-૬ નો મોબાઇલ કિંમત રૂપીયા ૫૦૦૦/- જેટલી ગણી શકાય. (૨) સેમસંગ કપનીનો વાયોલેટ કલરનો મોડલ m30-s નો મોબાઇલ ફોન જેની કિંમત રૂપીયા ૮૦૦૦/- જેટલી ગણી શકાય (૩)મોટોરોલા કપનીનો મોટો-G-મોડલનો મોબાઇલ ફોન કિંમત રૂપીયા ૫૦૦૦/- જેટલી ગણી શકાય (૪)સેમસંગ કપનીનો જે-૭ પ્રાઇમ મોબાઇલ ફોન જેની કિંમત રૂપીયા ૫૦૦૦/- જેટલી ગણી શકાય (૫)એપલ કપનીની સીરીજ -૩ મોડલની કાંડા ઘડીયાળ જેની કિ.૨૦૦૦૦/- જેટલી ગણી શકાય તથા કિ.રૂ.૪૩૦૦૦/-ને મત્તા સાથે મળી આવેલ હોય મજકુર પકડાયેલ બન્ને આરોપીઓને પુછપરછ કરતા નીચ મુજબના ગુનાઓને અંજમ આપેલાની કબુલાત કરેલ છે.

શોધાયેલ ગુનાઓ:

- (૧) રાંદેર પો.સ્ટે. A પાર્ટ નં. ૧૧૨૧૦૦૫૦૨૦૦૧૨૦/૨૦૨૦ ઇ.પી.કો. કલમ ૩૮૦ મુજબ.
(૨) રાંદેર પો.સ્ટે. A પાર્ટ નં. ૧૧૨૧૦૦૫૦૨૦૦૧૫૦/૨૦૨૦ ઇ.પી.કો. કલમ ૩૮૦ મુજબ.
(૩) રાંદેર પો.સ્ટે. ફ્લેટ ગુ.ર.નં.૧૭૯/૨૦૧૯ ઇ.પી.કો.કલમ ૩૭૯(એ) (૧),૧૧૪ મુજબ.
(૪) જહાગીરપુરા પો.સ્ટે. પાર્ટ ગુ.ર.નં.૧૧૨૧૦૦૦૭૨૦૦૦૪૧/૨૦૨૦ ઇ.પી.કો. કલમ ૩૮૦ મુજબ.

સદર આરોપીઓને તા.૦૧/૦૩/૨૦૨૦ ના રોજ અટક કરી કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે અને આ કામના આરોપીઓને પુછપરછ કરતા તેમજ તેઓનો ગુનાહીત પુર્વ ઇતિહાસ તપાસમાં ભુતકાળમાં નીચે મુજબના ગુનામા સંડોવાયેલ છે.

આરોપીઓનો પુર્વ ઇતિહાસ:

- (૧) રાંદેર પો.સ્ટે. ફ્લેટ ગુ.ર.નં.૨૪૭/૨૨૦૧૯ ક. ઇ.પી.કો. કલમ ૩૭૯, ૫૧૧ મુજબ.
(૨) રાંદેર પો.સ્ટે. ફ્લેટ ગુ.ર.નં.૩૪/૨૨૦૧૯ ક. ઇ.પી.કો. કલમ ૩૮૦ મુજબ.